

Date: 03/12/2025

To, **BSE Limited**Phiroze Jeejeebhoy Tower,
Dalal Street, Mumbai – 400 001.

Dear Sir/Madam,

Sub.: Intimation under Regulation 30 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 - Transfer of Equity Shares of the Company to the Investor Education and Protection Fund (IEPF) Account.

Ref: Security code-531814; ISIN: INE297[01023

Pursuant to Regulation 30 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("the Regulations"), kindly find enclosed herewith the copy of the letter dispatched to the shareholders of the Company on December 03, 2025. This letter is sent to the shareholders who have not claimed their dividend for a period of consecutive seven years from the financial year 2014-15 and 2016-17 respectively.

This enclosed reminder letter sent to the shareholders pursuant to Section 124(6) of the Companies Act, 2013 read with Investor Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016 as amended time to time, is to inform them that they should respond on or before March 02, 2026, failing which the Company will transfer/credit their shares to the demat account of the IEPF Authority as per the provisions of the Companies Act, 2013 ("Act") read with Investors Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016.

Kindly put the same on your records.

Thanking you,

Yours faithfully,

For Tirupati Sarjan Limited

Jitendrakumar Ishvarlal Patel Managing Director DIN: 00262902

Encl.: As Above

Phone: 079 - 4891 3751 Email: info@tirupatisarjan.com Website: www.tirupatisarjan.com



Date: 3rd December, 2025

Name of the Member:

Ref.: Folio No./DPID/ Client ID:

Dear Member(s),

Sub.: Compulsory Transfer of Equity Shares of the Tirupati Sarjan Limited to the Investor Education and Protection Fund (IEPF)

With reference to the captioned subject & pursuant to Section 124(6) of the Companies Act, 2013 ("Act") read with Rule 6 (3) of Investors Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016, as amended from time to time, ("Rules'), all shares on which dividend has not been paid or claimed by a shareholder for a period of seven consecutive years or more, shall be transferred by the Company to demat account of the Investors Education and Protection Fund Authority ('IEPF Authority') constituted in accordance of the Rules.

Upon transfer of such shares, all corporate benefits accruing on such shares shall also be credited to the IEPF Authority and the Voting Rights on such shares shall remain frozen till the rightful owner claims the shares.

As per the records of the Company, you have not claimed the dividend declared by the Company for the financial year 2014-15 for a period of seven consecutive years or/and more and therefore your shares are liable for transfer to the IEPF Authority.

Kindly take note that dividend unclaimed for financial year 2014-15 has been transferred to IEPF Authority. Further take note that unclaimed or unpaid dividend which have already been transferred or the shares which are being transferred by the Company to IEPF Fund or IEPF Authority including all benefits accruing on such shares, if any, can be claimed back by the shareholders from Investors Education and Protection Fund Authority ('IEPFA') by submitting an online application in the prescribed Form IEPF-5 available on the website https://www.mca.gov.in and sending a duly signed physical copy of the same to the Company or its RTA at abovementioned address along with requisite documents as prescribed under the Investors Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016.

The shareholder who shall respond to the company/RTA through email within three months of the date of letter i.e. till 02^{nd} March, 2026 through request letter stating not transfer shares and update KYC details along with below mentioned documents, then company will not transfer shares of them to the IEPF Authority to maintain interest of the shareholders.

Kindly provide the following list of documents along with Request letter:

a) Equity Shares held in Demat Mode:

Self-attested copy of Client Master List (CML) showing your name, address, email, contact no., demat details and updated bank account details registered against the demat account OR original cancelled cheque leaf bearing the name of the first holder.

b) Equity Shares held in Physical Mode:

Shareholders holding equity shares in physical form are requested to send the application duly filled & signed along with Investor Service Request Form ISR - 1, Form ISR - 2 and Form No. SH - 13 (Nomination Form) duly filled as per the instructions stated therein along with the supporting documents including original cancelled cheque stating your name as the Account holder OR bank attested copy of the first page of the Bank Passbook/ Statement of Account in original and a cancelled cheque.

Phone: 079 - 4891 3751 Email: info@tirupatisarjan.com Website: www.tirupatisarjan.com



Kindly note that as per SEBI circular dated November 3, 2021 and December 14, 2021 unclaimed dividend will be credited directly to the bank account of the shareholder if the folio is KYC Compliant.

SEBI has, vide the Circular No. SEBI/HO/MIRSD/MIRSD-PoD-1/P/CIR/2023/37 dated March 16, 2023, mandated the furnishing of PAN, address with PIN, mobile number, bank account details and nomination / opt out of nomination by holders of physical securities. Also, shareholders are requested to register the email ID with the folio, to be able to correspond and receive relevant communication.

In absence of communication from the shareholder whose shares are liable to transfer to the Investor Education and Protection Fund (IEPF) within stipulated time, take note that the company would be transfer the shares to IEPF Authority through Corporate Action.

In case the equity shares are held:

- In physical form, new share certificate(s) will be issued in lieu of the original share certificate(s) and transferred to IEPF Authority on completion of necessary formalities. The original share certificate(s) which stand registered in your name(s) and held by you, will stand automatically cancelled and be deemed non-negotiable.
- Demat form, the Company shall transfer the equity shares by way of corporate action through the Depositories to the IEPF Authority.

In case of any ambiguity, you may write to us at:

Tirupati Sarjan Limited

Registered office: A-11,12,13, Satyamev Complex, opp. Gujarat High Court, S.G. Highway, Ahmedabad,

Gujarat, India, 380060.

Email: cs.tirupatisarjan@gmail.com

Phone: 079-4891 3751

Website: https://www.tirupatisarjan.com/

M/s. Bigshare Service Private Limited

Registrar & Share Transfer Agent

Address: A-802 Samudra Complex, Near Klassic Gold Hotel, Off. C G Road, Ahmedabad–380009,

Gujarat.

Email: bssahd@bigshareonline.com

Phone: 079-49196459

Thank you.

For Tirupati Sarjan Limited

Sd/-

Jitendrakumar Ishvarlal Patel Chairman & Managing Director

Place: Ahmedabad



Date:03rd December, 2025

Name of the Member:

Ref.: Folio No./DPID/ Client ID:

Dear Member(s),

Sub.: Compulsory Transfer of Equity Shares of the Tirupati Sarjan Limited to the Investor Education and Protection Fund (IEPF)

With reference to the captioned subject & pursuant to Section 124(6) of the Companies Act, 2013 ("Act") read with Rule 6 (3) of Investors Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016, as amended from time to time, ("Rules"), all shares on which dividend has not been paid or claimed by a shareholder for a period of seven consecutive years or more, shall be transferred by the Company to demat account of the Investors Education and Protection Fund Authority ('IEPF Authority') constituted in accordance of the Rules.

Upon transfer of such shares, all corporate benefits accruing on such shares shall also be credited to the IEPF Authority and the Voting Rights on such shares shall remain frozen till the rightful owner claims the shares.

As per the records of the Company, you have not claimed the dividend declared by the Company for the financial year 2016-17 for a period of seven consecutive years or/and more and therefore your shares are liable for transfer to the IEPF Authority.

Kindly take note that dividend unclaimed for financial year 2016-17 has been transferred to IEPF Authority. Further take note that unclaimed or unpaid dividend which have already been transferred or the shares which are being transferred by the Company to IEPF Fund or IEPF Authority including all benefits accruing on such shares, if any, can be claimed back by the shareholders from Investors Education and Protection Fund Authority ('IEPFA') by submitting an online application in the prescribed Form IEPF-5 available on the website https://www.mca.gov.in and sending a duly signed physical copy of the same to the Company or its RTA at abovementioned address along with requisite documents as prescribed under the Investors Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016.

The shareholder who shall respond to the company/RTA through email within three months of the date of letter i.e. till 02nd March, 2026 through request letter stating not transfer shares and update KYC details along with below mentioned documents, then company will not transfer shares of them to the IEPF Authority to maintain interest of the shareholders.

Kindly provide the following list of documents along with Request letter:

a) Equity Shares held in Demat Mode:

Self-attested copy of Client Master List (CML) showing your name, address, email, contact no., demat details and updated bank account details registered against the demat account OR original cancelled cheque leaf bearing the name of the first holder.

b) Equity Shares held in Physical Mode:

Shareholders holding equity shares in physical form are requested to send the application duly filled & signed along with Investor Service Request Form ISR - 1, Form ISR - 2 and Form No. SH -13 (Nomination Form) duly filled as per the instructions stated therein along with the supporting documents including original cancelled cheque stating your name as the Account holder OR bank attested copy of the first page of the Bank Passbook/ Statement of Account in original and a cancelled cheque.



Kindly note that as per SEBI circular dated November 3, 2021 and December 14, 2021 unclaimed dividend will be credited directly to the bank account of the shareholder if the folio is KYC Compliant.

SEBI has, vide the Circular No. SEBI/HO/MIRSD/MIRSD-PoD-1/P/CIR/2023/37 dated March 16, 2023, mandated the furnishing of PAN, address with PIN, mobile number, bank account details and nomination / opt out of nomination by holders of physical securities. Also, shareholders are requested to register the email ID with the folio, to be able to correspond and receive relevant communication.

In absence of communication from the shareholder whose shares are liable to transfer to the Investor Education and Protection Fund (IEPF) within stipulated time, take note that the company would be transfer the shares to IEPF Authority through Corporate Action.

In case the equity shares are held:

- In physical form, new share certificate(s) will be issued in lieu of the original share certificate(s) and transferred to IEPF Authority on completion of necessary formalities. The original share certificate(s) which stand registered in your name(s) and held by you, will stand automatically cancelled and be deemed non-negotiable.
- Demat form, the Company shall transfer the equity shares by way of corporate action through the Depositories to the IEPF Authority.

In case of any ambiguity, you may write to us at:

Tirupati Sarjan Limited

Registered office: A-11,12,13, Satyamev Complex, opp. Gujarat High Court, S.G. Highway, Ahmedabad,

Gujarat, India, 380060.

Email: cs.tirupatisarjan@gmail.com

Phone: 079-4891 3751

Website: https://www.tirupatisarjan.com/

M/s. Bigshare Service Private Limited

Registrar & Share Transfer Agent

Address: A-802 Samudra Complex, Near Klassic Gold Hotel, Off. C G Road, Ahmedabad-380009,

Gujarat.

Email: bssahd@bigshareonline.com

Phone: 079-49196459

Thank you.

For Tirupati Sarjan Limited

Sd/-

Jitendrakumar Ishvarlal Patel Chairman & Managing Director

Place: Ahmedabad

Phone: 079 - 4891 3751 Email: info@tirupatisarjan.com Website: www.tirupatisarjan.com

markets volatile

Business Brief III

Sensex, Nifty recover from early fall as profit booking keeps



Apple appoints Amar Subramanya as vice president of AI

ple's senior vice president for Machine Learning and Al Strategy, is stepping down from his position and

down from his position and will serve as an advisor to the company before retir-ing in the spring of 2026. "Subramanya will be leading critical areas, in-cluding Apple Foundation Models, ML research, and Models, ML research, and AI Safety and Evaluation. The balance of Giannan-drea's organisation will shift to Sabih Khan and Eddy Cue to align closer with similar organisations." with similar organis Apple announced. Subramanya b

Apple announced.
Subramanya brings a
wealth of experience to
Apple, having most recently served as corporate

New Delhi, Dec 2 (IANS) After a festive lull in October, white-collar hir-ing has picked up pace with non-IT sectors such as education and real es-

tate have witnessed a solid hiring growth in November in India. according to

CHANGE OF NAME

CHANGE OF NAME
I have changed my old name
from PATADIA
KIRANK UMARI
BIPINK UMAR to new name
PATADIA KIRANE NA
BIPINEHAI
Add. 101-C, Nebula
Appa iments, Be in ind Galaxy
Tower, Boda idex,
Ahmedabad-39054

ber in India, accord a report on Tuesday

Cupertino (California), vice president of Al at MiDeo 2 (IANS) Apple has crosoft, and previously announced to appoint renowned Al researcher where he was head of enname Subramarya as vice gineering for Google's president of Al, reporting indenting for Google's president of Al, reporting in Separture, course in Company and the Company and the

His deep expertise in both Al and ML research and in integrating that research into products and features will be important to Apple's ongoing innovation and future Apple intelligence features, said the tech igard.

The view of the product of the view of view of the view of view o

Non-IT sectors in India witness solid hiring

growth in November: Report

Job portal Naukri's
JobSpeak Index recorded
a consolidated growth of
+0 per cent in the October-November period com-pared to last year. As per
the report, October had
registered a -0 per cent
year on year (YOY) due to
the advancement of Diwail
dates this year. In contrast,

I have changed my old nam from JASPREET ARVINDERJITSINGH

ARVINDERJITSINGH
SAHDTAto new name
JASPREET KAUR RAJBIR
SINGH SOND
Add. 971, Sunder Cotony,
Samratnagar kanpur
Ahmedabad-382443
3632

S. Korean govi says Coupang's electronic signature key exploited in data breach

Seoul, Dee 2 (IANS) A massive data breach attack against e-commerce giant Coupang Inc. that has affected over 30 million customers' data last-ed from June to November tion of the company's electronic signature key, according to officials on Tuesday.

"As we review all log data from July last year to November this year, we have confirmed that private data from more than leaked." Second Vice Minister Ryu Je-myung said during a parliamentary session.

"The attack was carried out from June 24 to November 8," reports Yonhap news agency.

November rebounde a +23 per cent gain.

CHANGE OF NAME

I have changed my old name from QURESHI YAKODB ASGARALI to new name QURESHI MOHAMMED YAKODBA SGARALI Add. 163, Peter Was, Darillinda, Ah medahad-380003 36538

hap news agency.

He said the attacker used Coupang's electronic signature key, which is required to access the

company's servers.
Ryu said a police investigation is needed to
identify the suspect, referring to reports of a purported former Coupang emCoupang members, was



company, claiming to have stolen more than 30 million ber, up 0.88 percent from a month earlier.

Meanwhile, South Ko-Meanwhile, South Ko-

Last week, the U.S.listed e-commerce giant said personal information of 33.7 million customers had been compromised,

vides over-night delivery of fresh food and daily ne-cessities, is one of the most widely used shop-ping platforms in South Ko-rea, with 34 million month-

rean shares extended their gains late Tuesday morning, buoyed by a strong performance in major chip stocks.

CHANGE OF NAME

new name RASHIDABEN ABDULSATTAR GHANCHI Add. 3/11/82/2, Vohrani Chail, Juni Shak, Market Kalol, Dist-Gandhinagar VO4S

CHANGE OF NAME ave changed my old name m PATADIA BIPINKUMA F

form Patadia, BiPinkuma, in BABUBHAIto new name Patadia, BiPin BABULAL Add., 101-C, Nebula A ppartments, Behind Galaxy Tower, Boda Mey, Ahmeda bad-380034 3854A

CHANGE OF NAME

have changed my old name from SATTARE HAI MUSAEHAI GHANCHIto new name ABD ULSATTAR MUSAEHAI GHANCHI

Tender Document to be downladed from website ritips://gmitilender.rgrooure.com www.gmitiporis.org Last date and time for the online

speed post only.

EM D to be submitted thorugh registered A D/speed post only.

Composite Stock Plice III-dex (KOSPI) advanced 63.79 points, or 1.63 per-cent, to 3,984.16, as of

decreased 1.35 percent, and leading battery mak-er LG Energy Solution was down 0.36 percent. The local currency

The local currency was trading at 1,469.5 won against the green-back as of 11,20 a.m., up 0.4 wonfrom the previous session's close.

CHANGE OF NAME

CHANGE OF NAME
have changed my old name
for MSUPKAT SWAM
DHARMANA LLA CHSWAMI
DO NO HARMANA LLA CHSWAMI
DHARMANA LLA CHSWAMI
DHARMANA LLA CHSWAMI
SHASTREE
Add. 475 MORIA
SWAMINIA GRAMANI
AND SWAMINIA GRAMANI
AND SWAMINIA GRAMANIA
AND SWAMINIA GRAMANIA GRAMANIA
AND SWAMINIA GRAMANIA GRAMANI

SHEKH LAZINA NASIRHIJSEN Add. Julaywada, Bahal Centre Shahpur, Ahmedabad-380004

CHANGE OF NAME

From 03/12/2025 BII 20/12/2025

20/12/2025 up to 18:00 Hrs

As per Clause no. 1.3 & 1.4 of the Bid Clause Till

or the Bio Clause Till 24/12/2025 up to 18:00 Hrs. 26/12/2025 at 12:00 Hrs (Or at such other date and time as may be notified

by G MB for the sald purpose, j

GUJARAT MARITIME BOARD
TENDER NOTICE: 23/2025

for "Permission to utilize ship recycling plots in Terms of the Gujarat Maritime Board (conditions and procedures for

the Gujarat Maritime Board (conditions and procedures for granting permission for utilizing ship recycling [plots] Ship Recycling Regulations- 2015 at Alang-Sosiya Ship Recycling yard, Dist Bhavnagar' on 'As is where is basis' for 4 (Four) nos of Schedule Tribe and 2 (Two) nos of Schedule Casts category plots, (Second Attempt)

Forfult he ridetalls please contact Dy.Ex.Engineer, Alang branch, GMB office, "Sagar Bhavan", Sector-10A, Opp Airforce station,

Chin Road, Gandhinagar or log on www.gmtsports.org or https:/ /gmbtender.nprocure.com

I have changed my old nam from PATELU IGAR BHAI VISHNUBHAI to new name PATELUIGAR VISHNUBHA 3649

markets volatile

Mumbai, Deo 2 (IANS) Indian stock markets opened with a sharp gap-down on Tuesday but soon recovered some losses as investors continued to book profits after the recent rally. The Sensex was trading at around 85,508, down 134 points or 0.12 per cent to 26,145. The Nifty's positional tradin remains builds, with storag support at the 28000-28050 zone. On the higher side, 2000-28050 zone. On the higher side of the continued of the con 63.79 points, or 1,63 per-cent, to 3,984.16, as of 11.20 a.m. Most-large cap shares traded higher. Chip giant Samsung Electronics in-creased 2.49 percent, and rival SK hyrus gained 3.72 percent. Carmakers also gained momentum, with No. 1 automaker Hyundai No. 1 automaker Hyundai Percent in contrast, defense giant Hanwha Aerospace decreased 1.35 percent, and leading battery mak-rand leading battery mak-rand leading battery mak-

Samsung unveils Calaxy Z TriFold.

Samsung unveils Calaxy Z TriFold, its 1st triple-folding phone

New Delhi, Dec 2 (IANS) Samsung Electronics on Tuesday unveiled the Galaxy Z TriFold, a new foldable smartphone that opens twice to reveal a large 10-lindi display.

With this launch, Samsung has expanded its leadership in innovative phone designs for the Ald the company said the TriFold builds on a decade of experience in the foldable category and introduces its most advanced engineering yet. The company continues to push boundaries to shape the future of mobile technology.

He added that the Galaxy Z TriFold solves one of the industry's biggest challenges by combinity in a single device Samsung said the TriFold was designed using insights from how people where devices. The unique multi-folding design uses an inward-folding mechanism that protects the main screen and includes an auto-alert feature that notifies users if the phone is folded incorrectly. The device is extremely slim at just 3.9 mm at its thinnest point and is powered by the customised of Singdagang as Elies Mobile Platform the largest battery ever used in a Samsung foldable, a 5.800 mAhthree-cell system spread across its panels.

India's FV26 inflation likely to average

India's Fy26 inflation likely to average below 2 pc, GDP growth at 7.7 pc.

New Delhi, Dec 2 (IANS) India's inflation is expected to average just below 2 per cent in Fy26 and to remain below the Reserve Bank of India's 4 per cent target in Fy27, a report said on Tuesday, 4s the October inflation came in at 0.25 per cent, the report from HSDC Global Investment of the control of t

IndiGo receives Rs 117.52 crore penalty over input tax credit denial

New Delhi, Dec 2 (IANS) InterGlobe Aviation, parent of IndiGo airlines, onTuesday informed that it received a penalty order of around Rs 117.52 crore from the Joint Commissioner of Central Tax and Central Excise, CGST Kochi Commissioner-

ate.

The order which issued a penalty of Rs 1,17,52,86,402 relates to the denial of input tax rordit for the financial years 2018–19 and 2021–22, the airline said in an exchange filing.

"The department has derived input tax credit (ITC) availed by the company and has issued a demand order along with penalty," the filing said.

"The company believes that the order passed by the authorities is erroreous. Further the combance of the state of the said of the company believes that the order passed the said of the said of the company believes that the order passed the said of the said of the combance of the said of the said of the company believes that the order passed the said of the said of the company that the said of the company that the said of the company that the said of t

backed by advice from external tax advisors," it further said. Accordingly, the company will contest the same before the appropriate authority, it added. InterGlobe Aviation added that the order does not have a significant impact on its financials, operations or other activities of the company. "There is no significant impact on financials, operations or other activities of the Company," it added in its regulatory filing. Interglobe Aviation Limited shares dipped by R5 80 or 1.64 per cent in intra-day trading. The shares had opened almost flat at Rs 5,704.50 apiece.

shares had opened almost flat at Rs 5,794.50 apiece.

The carrier on November 29 announced new direct routes and frequency additions from Navi Mumbai International Airport (NMIA), strengthening connectivity from the newly inaugurated gatework of the control of

ceived a bomb threat.
Official sources confirmed that the flight 6E-1234 was diverted midair after a threat message was received at the customer support at Rajiv Gandhi International Airport (RGIA) at 05.12 a.m.

CHANGE OF NAME

nave changed my old nam from AISHA MOHAM MED YAKODS to new name QURESHIAISHA QURESHIAISHA MOHAMMED YAKOOB Add. 163, Patel Was, Darillinda, Ahmedabad-380028

CHANGE OF NAME I have changed my old name from SHALKH SHAGUFA BANU JAVID MIY)

O NEW NAME SAGUFABANI SAMRAN SAIYED

CHANGE OF NAME

CHANGE OF NAME
I have changed my old name from SHAIKH
from SHAIKH
RUMANAYASMIN
MANBURLISLAM to new name RUMANAYASMIN
MOHAMMED MANBURLI
ISLAM SHAIKH
Add. 102, Ground Floor,
Raza Apartment, Gayanwad Hawell Road, Railmad,
Ahmedabad-380001 I have changed my old name from KAPADIYA MUZAMMIL ABDUKADAR BHAI to new name KAPADIYA MUZAMMIL ABDUKADAR Add. 408 Salil Residency 4th Floor Behnd Manyan Complex Tandaja Vadodara-3900 12



Tender Notice No.12 of 2025-26

Executive Engineer, Public Health Works Division, First Floor, Jal Bhavan, Behind Adarsh School, Palanpur-385001, Dist: Banask antha, Gujarat State invites tenders for 2 civil works amounting to total Rs.100-96 lacs of Palanpur taluka of Banaskantha District. Sr.No.1 and 2 works is invited by on line e-tendering vide tender ID No.248358, ID No.248353 works Last of submission of online tender Dt.17/12/2025 up to 18.00 hrs. Detailed details regarding tender are available on notice board of this office & web site www.statetenders.gujarat.gov.in http:/ /gwssb.nprocure.com All the corrigendum (if any) will be published

online only.
GWSSB Toll free Help line No.1916 for

Drinking Water Supply for Rural Area.



SARDAR SARDVAR NARMADA NISAM LIMITED

(A windly conned don't of dutard if braining to (A windly conned don't of dutard if braining).

Wo as Under the Executive Engineer, Harmada Project Main Canal Din No.3, Chanasina. The Finder Notice No.1 2et 2025-252.

Named No.1 2et 2025-252.

NOTICE

SARDAR SAROVAR NARMADA NISAM LIMITED

His.

Note: Agencies are requested to fill the tender after oftaining the awarness of work to be carried out and after the inspection of site of work where the work is to be carried out.

For further details please visit website https://lender.nprodure.com



Hemchandracharya North Gujarat University, Patan Advertisement No.-26/2025

Hermitandrachaya Horth Osjarat linherdsty, Patan Invites "ChilineApplications" for Various lob-n-Tasod-ing pool of the linhersty as per individuo of Education, Government of Osjarat, Oandhinagar vide Letter (Inc. Edulardent-Soaz-262747KR), 40, 2457652025.

Apply online though the university's recruitment portat "flips-line-out inerti. "guacolin Date of Commencement of online application schooling of 12720252

Last Cate of Online application submission: cdp. 47220253

Last Cate of Online application submission: cdp. 47220253

Last Cate of Online application schooling of 47220253

Last Cate of Online application schooling of 47220253

Last Cate of Online application submission: cdp. 47220253

Last Cate of Online application schooling of 47220253

Last Cate of Online application of 5720253

Last Cate of Online applic

Dr. R. N. Desal Registrar

ONLINE TENDER NOTICE NO.04/2025-26

Online Tender is invited for Total 07 works at Estimated invited cost of Rs.245.72 Cr From The Executive Engineer Panchayat Irrigation Division District Panchayat Patan	
Bid Document Download Commencement Date	03/12/2025 (11.00 Hrs)
Last Date of Online Submission of Tender	30/12/2025 (18.00 Hrs)
Last Date for Submission of Tender fee/interest	03/01/2025 (18.00 Hrs)
amount and other supporting Documents	
Date of Rid Occasion	0E (04/202E (44 00 Llee)

Date of bid Opening

The Phone Number of this office is 02768.234240. Tender St.Duc26 (11.00 Hrs)

The Phone Number of this office is 02768.234240. Tender Submission should be accompanied by latterhead with the address of correspondence (1) Tender fee (2) Bid amount (Valid 165 Days from the date of bid submission) (3) Copy of registration certificate (4) 20% of the Estimate amount Solvency certificate from a Scheduled Bank, or Nationalised Bank or Bank Approved for Government business (5) Copy of PAN card (6) Parthership, if any, parthership signature (7) Power Of Attorney (c) Affidavit/Undertaking as mentioned in SBD/Tender Document (9) GST number proofs and all the above documents should be scanned and uploaded online and listed on the agency's letterhead as physical documents and submitted in separate covers by registered postSpeed post. The name of the work and tender ID number should be written on the cover. Moreover, the document uploaded online will be considered final, Further Details can be the document uploaded online will be considered final. Further Details can be see at https://tender.nprocure.com

Note: Now the next updates will have to be checked online

TIRUPATI SARJAN LTD.
CIN: L45109GJ1999PLC024091
Regd. Office: A-11,12,13, Satyanev Compilex, Opp. Gujarat High Court, S.G. Highway, Ahr
Ph: 079-4891 3751 [E-Mail: cs.tirupatisasjan@gmail.com | Website: www.tirupatisa

NOTICE TO SHAREHOLDERS

TRANSFER OF EQUITY SHARES OF THE COMPANY TO INVESTOR EDUCATION AN PROTECTION FUND (IEPF) DEMATACCOUNT

IOTICE is published pursuant to the provisions of Section 124(6) of the Compani and along with Investor Education and Protection Fund Authority (Accounting, Aut oft Refund) Rules, 2016 (the Rules). The corresponding shares on which divi inclaimed for seven consecutive years will be transferred as per the procedure's

The concerned shareholders holding shares in electronic form, your demat account will t debited for shares liable for transfer to the IEPF. The concerned shareholders holding shares in physical form and whose shares are liable transferred to IEPF demat account, may note that the company would be issuing the Duptic shares to the IEPF Demat account. As per the Rules and upon such issue, the original shares to the IEPF Demat account. As per the Rules and upon such issue, the original certificate(s) which are registered in their name will stand automatically cancelled and deem non-negoliable. The concerned shareholders holding shares in dematicalized form may no that the Company shall inform the depository by way of corporate action for transfer of shares lawour of the DEMAT account of the IEFF.

In case of any ambiguity, you may write to us at: Tirupati Sarjan Limited Registered Office: A-11.12.13, Salyamev Complex, Opp. Gujarat High Court, S.G. Highway, Ahmedabad, Gujarat, India, 380060 Email: cs.tirupatisarjam@gmail.com Phone: 079-4891 3751

M/s. Bigshare Service Private Limited Registrar & Share Transfer Agent Address: A-802 Samudra Complex, Near Klassic Gold Hotel, Off C G Road, Ahmedabad—380009, Gujarat.

Sd/-Jitendrakumar Ishvarlal Patel Chairman & Managing Directo

શહેરમાં રખડતા કૂતરાઓનો આતંક, કોર્પોરેશને નોડલ ઓફિસરોની નિમણુંક કરી

(મિલિિલી) અમદાઘાદ, પાર્વાલિથી) અમદાઘાદમાં જાહેર સ્થળો પર તેમજ ખાનગી મોટી સંસ્થાઓ વગે દે જગ્યાએ સ્ખડતા કુતરાની સમસ્યાઓને લઈને ખ્યુનિશિયલ કોર્પોરેશન દારા કાર્યલાલી શરૂ કરવામાં આવી છે. સુપ્રિમ કોર્ટની આઇલાઇને પ્રમુખ રહેલે સ્ટેશન, બસ સ્ટેશન, સરકારી હોસ્પિટલો, જાહેર સ્થળો તેમજ મોટી અંગ્લાઓની પ્રમાણ કારોની જાહેર સ્થળો તેમજ મોટી અંગ્લાઓમાં સ્થળા કતારોનું લઈ મોટી અંગ્લાઓમાં ટેબાલ કતારોનું લઈ મોટી સંસ્થાઓમાં રખડતા કુતરાને લઈ કામગીરી કરવા માટે નોડલ કામગીરી કરવા મોટે નોકલ ઓહિસની તેમ ભાક કરવામાં આવશે. આવી જગ્યાઓ ઉપર રખદતા કુતરામે અદકાવવા માટે સિક્કલુરિટીને બુલાબકારી રહેતે ખૂબિલકનો મોહે આ બીક્સ રિમાવા માટેની સુચના આપવામાં આવેલી છે જાતે ર રજાળો અને ખાનગી શૈસિલક સેમાં પારે તેમ પ્રત્યાન પારે તેમ સુચના આપવામાં આવેલી છે જાતે ર રજાળો અને ખાનગી શૈસિલક સેમાં પરિપત્ર કરી નોકલ અહિસારી પારે પારે પારે તેમ આ બીકિસ રિમાવાનો રહેશે.

CNDD વિભાગના વસ નરેસ રાખપ્રતે બહાલ તેને જાત રસ્લો

રાજપૂતે જણાવ્યું હતું કે જાહેર સ્થળો જેવા કે રેલ્વે સ્ટેશન, બસ સ્ટેન્ડ મોટી હોસ્પિટલો તેમજ ખાનગી એકમો કે જ્યાં મોટી સંખ્યામાં લોકો આવતા હોય એકમોને આ અંતર્ગત

આણંદ એસટી ડેપોમાં નિવૃત્ત થતા

કર્મચારીઓનો વિદાય સમારોહ યોજાયો

(પ્રતિનિધિ) આણંદ,

આ ણાંદ એસટી ડેપોમાં ફરજ બજાવતા ટ્રાફિક કંટ્રોલર શ્રી

જ શવંતસિંહે પરમાર તથા ફારુક્રબાઈ વહોરા ટ્રાફિક કંટોલર

ફારુ કંપાઈ વહારા ટ્રાફિક કેટ્રાલર તેમજ રાજેન્દ્રસિંહ છાસટીયા ટાયર ફીટર નો વયમચાંદાને કારણે નિવૃત્ત થતા હોય વિદાય સમારોહ યોજાયો જેમાં કાર્યક્રમની શરૂ આતમાં ટ્રાફિક ઇન્સ્પેક્ટર શ્રી અક્ષય ભાઈ સોનેરા એ વિદાય હતા. દર્યકારી ઓ



આવેલા છે. અગાઉ કુતરા કરડવાનો બનાવ બનેલો છે કે કેમ તેની પણ કરવામાં આવશે. શહેરના પાલડી વિસ્તારમાં

.આર રબારી એ ઉપસ્થિત રહે પ્રસંગોચિત પ્રવચન કર્યો હતો. અ

પ્રસંગે મજૂરમહાજન યુનિયન તથા પ્રસંગે મજૂરમહાજન યુનિયન તથા કર્મચારી મંડળ અને ભારતીય મજદૂર સંઘ (બી.એમ.એસ) ના પ્રતિનિધિ મિત્રોએ સાલ ઓઢાળી ફલહાર કરી ભેટ સોગાદ

ખનાવ ખનલા છ કે કમ તેના પણ વિગતો આપવાની રહેશે. રખડતાં કૂતરાને પ્રિમાઇસીસમાં અટકાવવા માટે સિક્યુરિટી પૂરતી શહેરના પાલડા વસ્તારમાં ફરી એકવાર રખડતા કૂતરાનો આતંક સામે આવ્યો છે. થોડા દિવસ પહેલા જ બીએલઓ તરીકે

ટામ કારો તે વે પેકડા પાડેનામાં આવ્યું છે. શહેરમાં હાલમાં ર લાખથી વધુ કુતરાની સંખ્યા છે. ખસીકરણ કરવા માટે માત્ર બે ટીમ કાર્યરત છે. દરેક ટીમમાં ૪થી પ માણસો છે. પહેલાં ટીમમાં ૪થી ૫ માણસો છે. પહેલાં ૪ ટીમ હતી. પહેલાં દરરોજ ૧૫૦ કુતરાઓનું મેબીકિરણ થતું હતું. હાલ દરરોજ માત્ર ૩૫થી ૪૦ જેટલા કુતરાઓનું ખેતીકરણ થય છે. રોજ દુત્તરાઓનું હતું કુતર કરેડવાની કરિયાદો આવે છે. રોજના સરેરાશ ૧૯૪ જેટલા કુતરા કરડવાના કેસો બનવા પામ્પાં છે.

મેચર પ્રતિભાબેન જૈન આજે નિકોલ ખાતે મિની સ્પોર્ટ્સ કોમ્પ્લેસનું ખાતમુહૂર્ત કરશે

(ManGle) અમદાવાદ, અમદાવાદ મ્યૂ નિવિષ્ય લ કો પોર્ટેશ નદારા પૂર્વ ઝોનના મિકોલ વો દંમાં ૦૩ રિસે અન્દે રોલ આયોજીત કાર્યક્રમમાં અમદાવાદ મે યર પ્રતિભાળન જૈનના હસ્તે મિની સ્પોર્ટ્સ કોમ્પ્પ્રેસ,વિલિંગ પૂલ તથા જિમ્મેશિયમના ખાતમુહૂર્ત કરવામાં આવદા

(MGnGl2) અમદાવાદ , સ્પોટ્સ કોપ-પ્લેક્ષ, દિવયીગ પુલ અને અમદાવાદ કૃષ્ણ-મિસપ લ જીન-શિયમનું નિર્માણ કરવામાં કોપ્પેરેશ મદારા પૂર્વ અને અહીં રહ્યું છે. આ નિર્માણ વવાથી લોં બાં 0 3 ડી એ અને રોજે લે ને કર્યોગ, પીકલ બોલ કોર્ટ, આયોજીત ક્રાયંકમાં અમદાવાદ દિનિય કોર્ટ, યુટીલીટી બિલ્લીગ, મેપ ર પ્રતિભાગને જેનના હત્વે કિંજ પૂર્વ દ્વસ્થીગ પૂલ હુક કોર્ટ મિની સ્પપોર્ટનો કોપ્પોર્ટનો કોપ્યોર્ટનો કોપ્પોર્ટનો કોપ્પોર્ટનો કોપ્પોર્ટનો કોપ્પોર્ટનો કોપ્પોર્ટનો કોપ્પોર્ટનો કોપ્પોર્ટનો કોપ્પોર્ટનો કોપ્પોર્ટનો કોપ્પાર્ટનો કોપ્પોર્ટનો કોપ્પોર્ટનો કોપ્પોર્ટનો કોપ્પોર્ટનો કોપ્પોર્ટનો કોપ્પાર્ટનો કોપ્પોર્ટનો કોપ્પોર્ટનો કોપ્પોર્ટનો કોપ્પોર્ટનો કોપ્પોર્ટનો કોપ્પોર્ટનો કોપ્પોર્ટનો કોપ્પોર્ટનો કોપ્પોર્ટનો કોપ્પોર્ટનો

પ્રાંતિજના તાજપુરમાં જમીન પચાવી પાડનાર વિરૂધ્ધ ફરીચાદ નોંધાઈ

(પ્રતિનિધિ) હિંમતનગર, પ્રાંતિજ તાલુકાની ઓરણ ગામની સીમમાં જમીન ધરાવતા અને અમદાવાદના નાનાચિલોડામાં રહેતા એક ખેડૂતને સાઘ ચાર વર્ષ રહેતા એક ખેડુતને સાત્ર થાર વર્ષ અગાઉ કાયદેસર રાજકર વેચાણ દ સ્તાવે જેવી લીધેલ જમીનમાં બનાવાયેલ હોટલનું બાડુ નહીં આપીજમીન પાસી પાકી લોવાના આશેષ સાથે મેં કરીયાદ સોમવારે પ્રાતિજ પોલીસ સ્ટેશનમાં નોયાવા પામી હતી. આ અંગે અમદાવાદના નાના ચિલાંડામાં રહેતા દિલીષ વાસુર્ધે વ આપગલાઓને મોળટીન કરીયાદના

આસવાણીએ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યા મુજબ ગત તા. ૨૦ મે ૨૦૨૧ ના સમયગાળા દરમ્યાન તેમણે પ્રાંતિજ તાલુકાના તાજપુર-

ઓરણ ગામની સીમમાં આવેલ હોટલ સર્વે નં. ૩૯૩ ની અંદાજે ૦૦.૬૭.૫ર હે.આરે.ચોમી જમીન ૦૦ . ૯ ગપર હે અહેં સોચી જમીન વેચાલ દમતાં જથી રાખી હતી, જ્યાં તાજપુર ગામના પ્રયુપન સિંહ પ્રચિત્તાસિંહ રાઠો ડે હોટલ ભાકે આપી હતી, પટેલું ગમે કે નારભર દ પાર્ટ્સનો હોટલ બું બાર્ડુ નવી આપી પાર્તે માર્શિકની નહીં હોલ છતાં ગેરકામદે કબ્જો કરી દિલીખાઈ આસવાલી તાલ અન્ય લોકેને આ હોટલ લાભી જમીનમાં પ્રવેશના નહીં દઈ ગાળો બાર્ડી જાનવી માર્ટ દેશીયા આસવાલીએ તાજપુર ના પ્રયુપન સિંહ રાઠો દ વિરુષ્ય પ્રયુપન સિંહ રાઠો દ વિરુષ્ય સોમ વાર્ટ પ્રતિજ પેલીસ સ્ટેશનમાં કરીયાદ નોંધાલી હતી.

સાબરકાંઠા જિલ્લાના ૧૦ પી. આઈ અને

સાંબરકાંઠા જિલ્લા પોલીસવડાએ મંગળવારે જાહેર

ઇન્ટેન્ડર સૂચના નંબર: DRM (M) ADI/34/2025-26 લાકોપ્લ

ADI 218 www mats sits of facebook.com/WesternRty

લેસ્ટર્ન ટાઇક્સ વેસ્ટર્ન ટાઇમ્સમાં પ્રકાશિત જાહેરાતો અંગે વાંચકોએ પોતાની રીતે ચકાસણી કરી નિર્ણય લેવો. -જાહેરખબર મેનેજર

(પ્રતિા**નિદિ) હિંમતનગર,** પોલીસ સ્ટેશનમાં કરજ બજાવતા છ સાબર કાંઠા જિલ્લા પી.આઈની બદલી કરાઈ છે. તેજ સિવડાએ મંગળવારે જાહેર પ્રમાણે વિવિધ પોલીસ સ્ટેશનોમાં ફરજ બજાવતા ૧૮ પી.એસ.આઈની પણ પી.આઈની બદલી સાથે તેમની પણ બદલી કરી

Online 3u bmission up to Up to 16/12/2025 up to 18:00 Hrs.

Date on or before which the tender, Up to 17/12/2025, 14:00 Hrs. દેવામાં આવી છે. બદલી પામેલ અધિકારીઓને તરત જ નવા સ્થળે Online opening

Details and Tenders Available on Infip title nider, appropure, conti

સરદાર પટેલમાં કોટિલ્ચની કૂટનીતિ અને શિવાજીનું પરાક્રમ જોવા મળતું હતું: રક્ષા મંત્રી રાજનાથ સિંહ

સાધલી, સરદારજ ૧૫૦ રાષ્ટ્રીય એક્તા પદયાત્રા અંતર્ગત સાધલી ખાતે યોજા યેલી સરદાર ગાળામાં સંબોધન કરતા રજ્ઞા મંત્રી શ્રી રાજનાથસિંહે જણાવ્યું કે, એક રાજકીય વગ ઈચ્છતો હતો કેસ રદા રવલ્લ ભાગા ઇ ઈચ્છતાં હતાં કે કારદાર વલ્લભભાઈ પટેલ ઇતિહારના પાનામાં ખોલાઈ જ્યાપ પરંતુ, વારાખનાં ત્રી નરુભાઈ મોદીએ તે મને ઇતિહારના પાનામાં ચમકતા સિતારા તરીકે ખુનસ્થાપિત કરવામાં મહત્તપુર્ણ ભૂમિકા ભજવી છે. સરદાર પટેલે ભારતને આઝાદ કરાવવામાં અને તેની એકતા-અપેડિતતા સુરક્ષિત રાખવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આઝાદ આપ્રદાત આઝાદ

ભૂમિક ભજેલી હતી. આઝાંદ ભારતમાં રાજકીય શેત્રે ક્રમ કરનારા નેતાઓ પ્રત્યે અવિશ્વાસનું સંક્ર્ય પંદ થયું હતું, જ્યાં લોકે કહેતા હતા કે નેતા ભાલે છે કંઈક અને કરે છે કંઈક! ઉત્ત સંદર્ભમાં રજ્ઞા મંત્રીશીએ ઉમેર્યું કે, કહેવું અને કરવું (કહ્યી અને કરની) વચ્ચે અંતર ને લાં વું જેઇએ. આ પ્રેરજ્ઞા વર્તમાન સરકારે સરદાર વલ્લભભાઈ પહેલા પાસેથી લીધી છે. ભારતના રાજકારણમાં કામ કરનારા લોકોએ કથની અને કરનીમાં અંતર પેદ્ય કરીને નેતાઓ પ્રત્યે અવિશ્વાસનું પેછ કરીને નેતાઓ પ્રત્યે અવિધાસનું સંદર્ક ઊંબું કહું તેનું, જેને વડાયા ખન શ્રી મોદીના નેતૃત્વ માં અમારી સરકારે વિશ્વાસના રૂપમાં રતીકાર્યું અને દૂર કહું છે. અમે જે કોંગો કરીત કોંગ છીએ, અને જે અમે કરી શક્તા નથી, તે અમે બોલતા નથી, સરદાર પહેં કક્ત સરકાર ખનાવવાની રાજનીતિ નહોંતી કરી, પણ ભારત દેશના નિયાંબુ માટે જરાબીનિ કરી હતી તેમણે કહ્યું કે, સરદાર પટેલે

સરદાર૧૫૦ રાષ્ટ્રીય એક્તા પદયાત્રા અંતર્ગત સાધલી ખાતે ચોજાચેલી સરદાર ગાથામાં રક્ષા મંત્રી સહભાગી બન્યા

વિશ્વ સાથે તેની સરતો પર વાત કરે છે. વડાપ્રધાન સી મોડી ભારતને 20 ૪૭ સુ ધીમાં વિકલિક, સામાજિક, આપ્યાનિષ્ક અને આર્થિક એકનાન સુત્રમાં બોધવાનું કામ કરી રહ્યા છે, જેને દુનિયાની કોઈ તાલત રોકી નહી શકે સરદાર પટેલ તુષ્ટિકરભ્યાં વિશ્વાસ નહીતા કરતા ને પછે તે કાર્ય પ્રદેશ કોઈ સ્ટલ્ટી પાત્રમાં પ્રધાર કાર્ય હતા અને સો માના માટે રો કર્યો હતાં અને સો માના માટે સો કર્યો હતાં અને સો માના પાર્ટ સો કર્યો હતાં અને સો માના પાર્ટ સો જ્યાં આપ્યાને સમાન્દ સ્પાર્થ હતું. આજે આપો આપાં સમાન્દિ પણ હતું. આજે આપો આપાં સામા માદિર પણ સક્ષ્કરના ખુજાના માદિ ત્યાં હતું. સરકારના ખજાનામાંથી નહી, પરંતુ દેશની જનતાના ખર્ચે બની રહ્યું છે. સરદાર પટેલની આ વિરાસતને જાળવી

માંડવિયા, રાજ્યના કૃષિ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ પ્રાસંગિક પ્રવચનો કર્યાહતા.

પ્રવેષ નો કર્યા હતા. આ વેળાએ કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી સાંભા કરે દલાજે, મંત્રી શ્રી કુંવરજીબાઈ ભાવિભાય, રાજ્ય મંત્રી શ્રી કાંતિભાઇ અમૃતિયા, શ્રી કોરિકભાઇ વેકરિયા, સાંસદ શ્રી મનસુખભાઇ વસાદા અને ડો. હેમાંગ જેશી, પ્રમુખ દેવાદ જાયાં હતા. સહિત સામજનો ઉપસ્થિત રહ્યા હતા.

ઇંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર રોબિન

ક્રિક્ટ સ્ટર રી બિના સ્મિયનું of GE of (એજન્સે) નવી દિલ્લી, ઇંગ્લેન્ડનો પૂર્વ ક્રિકેટ્ટ ઇંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટ્ટ ઇંગ્લેન્ડના સ્મિયાનું રાબ્દ નથી વિજન્દ સુધી ઇંગ્લેન્ડના માટે લ્ટ ટેટ્ટ મેંગ અને ૭૧ વર્ના? અને હિંદનો અને ૧૫૦ વર્ના વર્લ કરી. આ દુખ્યદ સમયાયારથી ક્રિકેટ જનાતમાં શાક છવાઈ ગયો છે. રોબિન સ્મિયાની કાર્ટી કરીને માટે લ? ટેટ્ટ મેંગ રસી હતી વાત કરીએ તો, તેમાર્થ ઇંગ્લેન્ડ માટે લ? ટેટ્ટ મેંગ રસી હતી તો સાથ સમયામાં દરમિયાન, તેમણે ૪૩. ૯૭ ની સરેસાશથી ૧૨. ૩૯ ના ત્રાન્યા હતી. ત્ર-જ કહ. ૧૭ ની સરેરાશથી ૪,૨૩૧ રન બનાવ્યા હતા, જેમાં નવ સદીનો સમાવેશ થાય છે, જેમાંથી ત્રણ વેસ્ટ ઇન્ડીઝ સામે હતી.

ઉધમતપુરા ગામે દીપડાએ હુમલો કરતા ૪ વ્યક્તિઓ ઘાયલ

(प्रतिनिधि) नडिथाह, ઠાસરો તાલુકાના ઉધમતપુરો ગામ વિસ્તારમાં દીપડો દેખાવાના ગામ વિસ્તારમાં દીપડો દેખાવાં થ કારણે સામીકોમાં દીડામા અને ભયનું વાતાવરણ જોવા મળ્યું હતું. દીપડાના ધુમવામાં ચાર વ્યક્તિઓ ચાયલ થતાં તેમને તાન્કાલિક સારવાર માટે ખત્રે કાયા છે. ગામલોકોમાં વધુ ભય કેલાયો છે અને વન વિભાગે દીપડાને પકડવા માટે વિસ્તારમાં પોજરા ચોઠલા છે. મળતી માહિતી મુજબ હાસરા પ્રદાસ કરવાર હાસ્ત્ર કરવાર પ્રા

તાલુકાના ઉધમતપુરા ગામ વિસ્તારમાં દીપડો દેખાવાના ક્રરણે વિસ્તાંત્રમાં દ્રીપણે દેખાંવાના શ્રુરણે ખની હતી અને દેપિડાને પકડવા સામજનોમાં ભારે દોડ ધામ અને ખાટે તાતકાલિક વિસ્તારમાં પોજરા ભયાનું વાતાવરણ સર્જાયું છે. આ રોઠવ્યા છે. વન્ય પ્રાણી રહેઠાણ દોષાકાએ ચાર જેટલા ગ્રામજનો પર હુમલાં કરતાં તેઓ ઘાયલ જ્યા પ્રશ્ન પણ મહત્વનો ભન્યો છે, અને હતા, જેમની તાત્કાલિક ચારવાર શક્ત કરવામાં આવી છે. દીપડો લઈ ભારે ભયનું વાતાવરણ જોવા દેખાયો તે સમયે ગામમાંથી પસાર થતી નદીપાસે મોટી સંખ્યામાં લોકો અને કાય તાલુકાના ઉધમતપુરા એકંઠા થયા હતા. તે જ વખતે કિંપ શે દેખાયાની ઘટના એને નાયળ

AHMEDABAD MUNICIPAL CORPORATION

STP DEPARTMENT E-SHORT TENDER NO.: 33/2025-26

Name of Work

Operation and Comprehensive Maintenance with Repairing of all Electrical & Mechanical Equipments & instruments of VASNA BARRAGE dealnage Sewage Pumping Station of AMC for One Year.

Augmentation work of electrical, machanical & instruments to the works for existing sewage pumping station (sps) at bag e firdosh of Ahmedabad municipal corporation.

Name of Work

બહાર આવ્યો હતો અને એક વ્યક્તિ પર હુમલો કરી તેને ઘાયલ કર્યો હતો, જેના પગલે સમગ્ર વિસ્તારમાં વધુ ભયનો માહોલ ફેલાયો હતો. ગામની સીમમાં દીપડો આવ્યો છે ગામની સીમમાં ડીપડો આવ્યો છે તે જાલીને ગામના યુવાનાં ડીપડાને ભગાડવા માટે સીમમાં ગયા હતા તે વખતે દીપડાએ હુમલાં કરતા કુલ યાર વ્યક્તિઓ ઘાયલ થયા હતા. જેનં કારણે લોકોમાં દહેશત વધી છે અને લોકો ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે. ઘટનાની જાણ વર્તાજ વન વિભાગની ટીમ સક્લિય બની હતી અને દીપડાને પકલા પણ હતી કહેલા કિસ્તારા પંકાલ

વન સંરક્ષક અભિષેક સામરીયાની એ સ્થાનિક્રોને સાવચેતી રાખવા માટે અપીલ કરી છે અને જણાવ્યું હતું કે દી પડો દેખાય તો સ્થાનિકો ૯૩૨૭૧૦૮૮૭ દ આ નંબર ઉપર અંગે સહિય બનીન કામગીરી કરી રહ્યું છે. સ્થાનિકોને ગીચ વિસ્તારમાં જવાનું ટાળવું સાથે જ બાળકોની એકલા ન મુકવા અપીલ કરી છે.. ઘરની આજુબાજુ સાક-સકાઇ રાખવાની સાથે સાથે થર પાસે બાંપેલા ઢોર પાસે સુવું નહિ તેવી જાળકારી આપી છે.. આ વિસ્તારની જાણ કરા ગાય છે.. આ લેસ્તારમાં નજીકના વિસ્તારમાં હાલ ઠોર ચરાવવા જવું નહી તેવું કહેવાની સાથે સાથે તેમની જણાવ્યું છે કે, વન વિભાગ આ દીપડાને પકડવા સક્રિય છે. અભિષેક સામરીયાએ

છે. અભિષેક સામરીયાએ સ્થાનિશ્રેને આ અંગે ખાસ અપીલ કરી છે કે જો દીપડો તેમપીલ વિસ્તારમાં દેખાય તો તાત્કાલિક વન વિભાગના ઠાસરા તાલુકાના ઇઢં વિજયને જાણ કરવા જણાવ્યું છે

<u>અતુલ ખાતે ૧૬ મો ઉલ્હાસ કપ</u> ઇન્ટર સ્કૂલ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં એમ.કે મહેતા હાઇસ્કૂલની ટીમ વિજેતા

તેમજ રાજેન્દ્રસિંહા છો કાટીયાટો ઘર કેવી ભોટ સોંગાદ કોટ નો વખતારે તે કરાવે વિતૃત્ત આપીનિવૃત્ત થતા કર્યો માન્ય આપીનિવૃત્ત થતા કર્યો માન્ય આપીનિવૃત્ત થતા કર્યો માન્ય આપીનિવૃત્ત થતા કર્યા કરાવે કરાવે હતા. આ પ્રશે કર્યો કરાવે કરવે કરાવે કરાવે કરાવે કરાવે કરાવે કરાવે કરાવે કરાવે કરવે કરાવે કરાવે કરાવે કરાવે કરાવે કરાવે કરાવે કરવે કરાવે કરાવે કરાવે કરવે કરાવે કરવે કરાવે કરાવે



(પ્રતિનિધિ) અતુલ, ઉલ્હાસ જીમખાના અતુલ ાયોજીત (U-19) ઇન્ટર સ્કૂલ કેકેટ ટ્રનામેન્ટ (વલસાડ જિલ્લા) ની માહિતી આપતા ઉલ્હાસ જીમખાના ના જનરલ સેકેટરી શ્રી જે ડી પટેલે જણાવ્યું હતું કે તારીખ ૧૦/૧૧/૨૦૨૫ થી ૨૦/૧૧/ ૧૦/૧૧/૨૦૨૫ થી ૨૦/૧૫/ ૨૦૨૫ સુધી માલેલ આ ટ્રાનોમ્ટ-માં વલસાડ જિલ્લા ની ૧૯ ટીમો જે લેલા કે કરવાણી સાળા (બતુલ), કે વો સીપ હાઈસ્કુલ (વાપી), એ મ. ડી. ડી. આઈ. હાઈસ્કુલ (ઉંમરગામ), આર. એમ. વી. એમ. હાઈસ્કુલ (વલસાડ), નેવલ જે એક હાઈસ્કુલ (વલસાડ), નિલક્ક એફેડથી

ગુરફુલ હાઇસ્કૂલ(ધરમપુર), બી.આર. જે.પી. હાઇસ્કૂલ બી.આર. જે.પી. હાઇસ્કૂલ (પારડી), સી.આર.દેસાઇ મારૂતિ હાઇસ્કૂલ (અબ્રામાં), એમ.કે. મહેતા હાઇસ્કૂલ. (ઉંમરગામ), શેઠ.આર. જે.જે. હાઇસ્કૂલ.(ઇ.એમ.)વલસાડ,

સ્ટીલિંગ હોસ્પિટલ્સે ઇમરજન્સી રિસ્પોન્સ એમ્બ્યુલન્સ સર્વિસ શરૂ કરી

અમદાવાદ, ગુજરાતની અગ્નણી મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ ચેઇન પૈકીની એક સ્ટેલિંગ હોસ્પિટલ્સ અમદાવાદના નાગરિકોની સેવા માટે ખાસ ઇમરજન્સી રિસ્પોન્સ માટે ખાસ ઇપર જન્યો રિસ્માંના માનિગટિંગથી શ્રેષ્ઠ ભનાવવામાં એમ્બ્યુલના સેવા શરૂ કરવાની આવી છે. આ ઉપરાંત રહિંવા ગર્વભેર જાહેરાત કરે છે. આધુનિક હોસ્પિટલ્સના ઉચ્ચ ફુમાના પંચાલની ટેકનોલોજી અને કમાન્ડ સેન્ટ્રથી અને પ્રોકેશનલ મેડિકલ ટીમ જેને સજુ આ એમ્બ્યુલન્સ સેવા હોસ્પિટલ સુધી પહોંચતા પહેલા દર્દીઓને ઝડપી અને વધારે દર્દીના સ્વાસ્થ્યને લગતી મહત્વની અસરકાર ઇપ્યત્રભ્યો સારવાર, પાડેલા સહિત તમામ પત્યત્વી હવાર પર પ્રાક્ષ કરીને કામ મીરીઓ સાગતાલી હાલા પર રો. અમદાલાદમાં કોઇપણ હોસ્પિટલ જેના વીપદાને અમદાસ્થાન કોઇપણ હોસ્પિટલ જેના વીપદાને અને ઝડપી સુધી પહોંચલા માટેની રાહત મળીશકશે.

આંલ આઉટ થઇ હતાં. મન આફ પ મેચ, મેન ઓફ ધ સીરીઝ ના બગ્ને ઇનામો એમ. કે મહેતા હાઈસ્કૂલ નાં ખેલાડી શ્રી પ્રભાત ચૌહાણ નાં કાળે ગયા હતાં અને બેસ્ટ બોલર તરીકેનું ઇનામ રવિન્દ્ર સિંગ ને મળ્યું હતું.

એમ્બ્રુલનમાં રોવા મેળવી શકે છે. અમદાવાદના નાગરિકો માટે આ એમ્બ્રુલન્સ તેવા નિરામુંદ રહેશે. આ તેવાને એમ્બ્રુલન્સના સતત તથા ઈન-તાઉસ લાઈવ મોનિટ દિગાઈ શેષ્ઠ બનાવવામાં આવી છે. આ ઉપરાંત સ્ટેલિંગ હોસ્પ્ટરસના ઇન્સ્ટ્રાફળતા ધરાસ્ત્રીય હોસ્પ્ટરસના ઇન્સ્ટ્રાફળતા ધરાસ્ત્રીય હોસ્પ્ટરસના ઇન્સ્ટ્રાફળતા ધરાસ્ત્રી હોસ્પ્ટરસના પહેલા મહેલ્લ માસિના સાસ્ત્રીયને વસ્ત્રીય મહત્વની

૧૮ પી. એસ. આઈની આંતરિક બદલી

યા તાસપડાએ મેનળપાર જાહેર હિતને ધ્યાનમાં રાખીને ૧૦ પી.આઈ અને ૧૮ પી.એસ.આઈની જિલ્લાના અન્ય પોલીસ સ્ટેશનોમાં આંતરિક અન્ય પાંલીસ સ્ટેશનોમાં ઓતીરેક બદલી કરતા કેટલાક પી.આઈ અને પી.એસ.આઈમાં તેના મિશ્ર પ્રત્યાઘાત પડયા છે. જિલ્લા પોલીચલડા હે.પાર્વરાજસિંહ નોહિલે જાહે રહિતાને ધ્યાનમાં રાખીને ગાંભોઈ, વિજયનગર,એમ.ઓ.બી શાખા, ઈંડર, તલોદ અને ખેરોજ

परक्षादी पाणी संग्रह प्रवासीनी क्षेत्रवार्ध, स्थापन सने क्रिशनिंग

AUI/34/2025-26 લાકો ખ ૨૦.૧૧.૨૦૨૫ પીસેવા કામ માટે લાવા ક્રાં કોન્ટ્રાક્ટરો પાસેથી ઈ-ટેન્ડર મેંગાલવા ક્રાં અવે છે. જમ્મનું નામા કોચિંગ ડેપો, કાંકરિયા ખાતે વરસાદી પાણી સંગ્રહ પ્રકાહી (૨નેંગ) ની ભેગવાઈ, સ્યાપન અને ક્રિશાનિક ખારે કોકરિયા ખાતે વરસાથી પાણી સંખ્યા ક્યારાથી (ર વર્ગ) તો જેવાઈ, સ્થાપન અને કરિયાનિય માટે કરાર કાર્ય, ટેન્ટર વેબાદ, M.442 /197KWHKKK-કાર્યાની પુત્રા અંદાકરિયા ખાશે ટ્રો. ચ.૫. 0,6/20.00 (ટ્રીપાયા પાંતીસ હ્યારા કરે, છે. 2,000/ ટ્રીપાયા ઇંક્કોરેન્દ્ર બજાર એસે પાત્ર) ટેન્ટર હાંક અને ઓક્ટર્સાના વાર્ટમાં અંદાન પ્રકાર કરે. છે. 2,000/ દ્રીપાયા ઇંક્કોરેન્દ્ર બજાર એસે પાત્ર) ટેન્ટર હાંક અને ઓક્ટર્સાની વાર્ટમાં અંદા ૧૩૦૫ માં રીજ પાત્રે મુંદ્ર કરતા હોંક ૧૩૦૫ માં રીજ પાત્રે મુંદ્ર કરતા હોંક ૧૩૧૧ માં રીજ પાત્રે મુંદ્ર કરતા હોંક પાત્ર એક્ટર્સાની પાત્રું અને પાત્રું ૧૩૦૫ માં રીજ પાત્રું માને પાત્રું ૧૩૦૫ માને પાત્રું અમાદાલા (પાર્ચમ લેલે) ૩ ૮૦૦૫ માને પાત્રું અમદાલાદ (પાર્ચમ લેલે) ૩ ૮૦૦૫ લેલે)

અમદાવાદ મ્યુનિશિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ ટ્રાન્સપોર્ટ લાઉરા, જમલપુર દરવાજા બલાર, બ્રહેરામપુરા, અમદાવાદ-૩૮૦૦૨૨ ફોના નં.૦૦૮-૨૫૩૮૧૮૧થી ૮૬

તમ્યું કો/પી.ઝબલ્યુ કી/સી. પી. ડબલ્યુ કી/ આર એન્ડ બી, અથવા સમકથ સંસ્થામાં માન્ય ફ્લીમાં રજીસ્ટ્રેશન ધરાવતા કોન્ટ્રાક્ટરો પાસેથી ઓન લાઈન, ઈન્ટેન્ડરીંગ વિસ્ટમથી નીચે

હેલામિંગ રજારેલમ 'વાલાના કોન્યુકારો' પહેલી ખોત લાઈન, ઈ-ર-ટીંગ વિસ્ત્રમાંથી નીસે જમારેલ કામી કારાવ માટે ટેન્ડ કારંડ ભાવ મેંગાવવામાં અને છે. ટેન્ડ ને 1. રે/પગ ૨ ૯ માનુગૂર, તા તાર પોટોનિંગન માટે વાલી ઉત્તર પવિમા ગોનના પુત્રમાં નીમી નિર્દેશમાં ને. ર (ફાફર) કે, ખોટે ને. ન્ટ ૧૫ પોટાંથી પોટોનિંગલ બનાવલા માટે પુત્રમાં નીમી નિર્દેશમાં કે બાળ કરવાના કામાળાના કે પોટોનિંગલ બનાવલા માટે પુત્રમાં તેના કે બાળ કરવાના કામાળાના કે પોટોનિંગલ બનાવલા માટે પેટન તીકારમાં નિર્દેશમાં કરવાના કર્યા કર્યા કરી કર્યા કર્યો ટેન્ટ રાઈમાંકો, અન્યલોક કરવાની છેલી તારીખતા ને ગોન રોનેલ્ટ પ્રત્યા સ્થામ કરતા છતા કર્યા કર્યો કર્યા કર્યા ૧,૦૦ કામા કર્યું લાભ્યો માટેલ કર્યા કરવાના કર્યા કર્યા કર્યા કર્યા કરતા કર્યો કર્યા કર્યા ૧,૧૦૦ કર્યા કરતા કર્યા કર

વોટસએપ ૭૦૪૯૦૧૫૭૩૫

તે બદલના પુચવા કોઈનો કોઈપણ

પ્રવાદેવી મું CIN B88000W H2010PLC209858 - IRDAI તોપ્

Franklin Templeton Mutual Fund

Date: 5th December, 2025 Time: 7:00 p.m.

ntact Person: Jigar Desai (9725043004 Due to limited seats, entry will be provided to registered atter only. Please call on the above number to register by tomor We look forward to your participation.

FRANKLIN TEMPLETON

ed office: One International Centre, Tower 2, 12th & 13th Flo napati Bapat Marg, Elphinstone (West), Mumbai - 400013

Mutual Fund investments are subject to market risks, read all scheme related documents carefully.

તિરૂપતિ સર્જન લિમિટેડ

ટાજ દાકાર દાકાર દાકાર કરવામાં કોમ્પ્લેક્સ ગુજરાત હાઇકોર્ટ સામે, એસ.જી. હાઇવે, અમદાવાદ-380060

આ સૂચના કંપની અધિનિયમ 2013 ની કલમ 124(6) ની જોગવાઈએ અને રોકાણકાર શિક્ષણ અને સુરક્ષા લેકો સત્તામડળ (બેકાઉન્ટિંગ, ઓક્ટિ, ટ્રાન્ટ્સર અને રિફડ) નિયમો, 2016 (નિયમો) અનુકાર પ્રકાશિત કરવામાં આવે છે. જે છે. ૧૫ દેકિવંડન્ક સત્ત સત્તા તર્ય મુંચી દેવો ન કરવામાં આવ્યો હોય તે નિયમોમાં દેશવિવ પ્રક્રિયા અનુસાર ટ્રાન્સર કરવા

ધારકોએ નોંધ લેવી જોઈએ કે IEPF ડીમેટ ખાતામાં ટ્રાન્સફર કરાયેલા ઇવા વગરના ડિવિડન્ડ અને સંબંધિત શેર, જો કો તો, ઉપરોક્ત નિયમો દ્વારા નિર્ધારિત પ્રક્રિયાઓનું પાતન કરીને IEPF ઓથોરિટી પારોથી પાછા ઇવો કરી શકાય છે.

. કલેક્ટ્રોનિક સ્વરૂપમાં શેર ધરાવતા સંબંધિત શેરધારકો, તમારા ડીમેટ ખાતામાંથી IEPF માં ટ્રાન્સફર કરવા પાત્ર શેર બ્રિઝ કરવામાં આવશે

લોવિક સ્વાપ્રમાં શેર ધરાવતા સંબંધિત શેરધારકો અને જેમના શેર (EPF ડીમેર ખાતામાં ટ્રાન્સકર કરવા પાત્ર છે, તેઓ નો! લાઈ શે છે કે કંપની EPF ડીમેટ ખાતામાં શેર ટ્રાન્સકર કરવાનો હતુવી તેમના દ્વાર રાખવામાં આવેલા પૂર્ણ શેર પ્રમાણપત્રન બાલ ડું પિલિક શેર પાત્ર પાત્ર પાત્ર અને આવ્યા કર્યું હતું કરી. નિવાસે અનુસાર બને આવા હરવુ પડ પત્રના નામી નોધારી અને પ્રમાણ પાત્ર આણે આપણે તે દર શે અને બિન-વાટાસાટામાં માનવામાં આવશે. ડ્રિપ્ટોરિયાલાઇન્ડ કોર્યમાં શેર પાસ્પ્રવાન હતીવાદ સંશ્રાહાર્કિઓ નો પાત્ર બે અને બિન-વાટાસાટામાં માનવામાં આવશે. ડ્રિપ્ટોરિયાલાઇન્ડ કોર્યમાં શેર પાસ્પ્રવાન

ારાયાર-સરાયાર-અનુસાર દાઇન ગીપ નોંધ લેવી જોઈએ કે કંપની દ્વારા તેની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવેલી વિગતોને નિય અનુસાર દાઇન ડીપેટ ખાતામાં શેર ટ્રાન્સફર કરવાના હેતુથી કંપની દ્વારા કૃપ્લિકેટ શેર પ્રમાણપત્ર(ઓ) જારી કરવા સંદર્ભમાં પૂરતી સૂચના માનવામાં આવશે અને માનવામાં આવશે.

ઈપણ અસ્પષ્ટતાના કિસ્સામાં, તમે અમને લખી શકો છો

મેસર્સ બિગશેર સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ

તિરુપતિ સર્જન લિમિટેડ માટે એપની (અલગ/-જીતેન્દ્રકુમાર ઇશ્વરલાલ પટેલ થેરમેન અને મેનેજિંગ કિરેક્ટર